

**અરજદારની ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૪૫૧ અને ૪૫૭ મુજબની અરજી લગત હુકમ**

(૧) અરજદારશ્રી CHIRAG AMBALIYAની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિધવાન એ.પી.પી.શ્રીને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે , તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના અરજદારની બેંક **Axis Bank State Bank of India, ICICI Bank, Federal Bank ના ખાતા નંબર 921010030193324 , 32453397388, 183601513324, 55550101030466 માંથી કુલ રૂ. 491000/- ઉપડી ગયેલ હતા.** જે બાબતે તેઓએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930/100 ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ તા. **8/8/2023** તારીખના રોજ ટિકિટ નંબર **31108230100116** થી નોંધાયેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેઓના ગયેલ નાણાં પૈકી સામાવાળાના બેંક **Axis Bank, State Bank of India, State Bank of India, Indian Bank (including Allahabad Bank), State Bank of India, State Bank of India, Bank of Baroda (Including Vijaya Bank and Dena Bank), Bank of Baroda (Including Vijaya Bank and Dena Bank), South Indian Bank, bank of india, Axis bank, Andhra Pradesh Gramin Vikas Bank, Axis Bank, Federal Bank ના અનુક્રમે ખાતા નંબર 920010054718171, 35446828450, 39760155701, 6634934200, 33528327025, 20178111120, 48080100004913, 40900100009749, 632053000003958, 875410110000796, 911010008014885, 73196723126, 0923020007567823, 17440200003449 માંથી અનુક્રમે રૂ. 76000/-અને 10943અને 20905/-અને 1002/- અને 50000/- 17000/-, 28584/-, 6712/-, 7000/-, 20000/- અને 100000/- 17000/- , અને 6208/-, 15000/- મળી કુલ રૂ. **3.76354/-** રૂપિયા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે, આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી. તેઓને ખુબ જ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૪૫૧ અને ૪૫૭ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.**

(૨) અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગરનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, ગાંધીનગરનાઓએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાંને તાત્કાલીક રોકવા તથા ગુના અટકાવવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ હેઠળ હેલ્પલાઇન સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઈડી ક્રાઇમ હસ્તક ચાલુ છે અને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે આ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરજ બજાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણાં જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલીક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરીયાદ હેલ્પલાઇન નંબર ૧૦૦/૧૯૩૦ પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટીકીટ નંબર આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેન્કખાતામાં જે-તે નાગરીકના નાણાં ગયેલ હોય તે બેન્કને નાણાં ફીઝ કરાવવા તેમજ જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી સીઆરપીસીની કલમ ૯૧ તથા ૧૦૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેન્કો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણાં ફીઝ કરવામાં આવે છે.

વધુમાં અરજદારની અરજીની હકિકતો જણાવી વાદગ્રસ્ત રકમ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સાડ તેઓનો અભિપ્રાય માંગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે, જે ખાતામાં રૂપિયા ફીઝ થયેલ છે જે સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાઈ આવેલ છે તથા સદર હુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

(૩) સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેન્ક પેપર્સની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા ફરીયાદીના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેન્કના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદુપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા હાલના કામે આજદીન સુધી કોઈ એફ.આઈ.આર. થયેલ હોય કે હાલના કામે કોઈની ધરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી. તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાંની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદુપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતાં તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ જણાતું નથી. તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદર હુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણાં અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આવેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાંનો કબ્જો મેળવવા હક્કદાર હોવાનું જણાય છે.

(૪) આ તબક્કે સદર નાણાં પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૭ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે.

#### કલમ- ૪૫૭

કોઈ પોલીસ અધિકારીએ મિલકત કબ્જે લીધાનો આ અધિનિયમની જોગવાઈ હેઠળ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવામાં આવે અને તપાસ કે ઈન્સાફી કાર્યવાહી દરમિયાન ફોજદારી ન્યાયાલય સમક્ષ તે મિલકત રજુ ન કરવામાં આવે ત્યારે, મિલકતના નિકાલ સંબંધી અથવા તેનો કબ્જો ધરાવવા હકદાર વ્યક્તિને તે મિલકત સોંપી દેવા સંબંધી અથવા તે વ્યક્તિ અંગે ખાતરી કરી જાણી ન શકાય તો, તે મિલકતની કસ્ટડી અને તેને રજુ કરવા સંબંધમાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે.

આમ સદર કાયદાકીય જોગવાઈ મુજબ જ્યારે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જમીની જાણ મેજિસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબ્જા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

આમ ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતાં સદર નાણાં બેન્કમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩(૧) જી.એલ.એચ. પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવાપાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

#### હુકમ

- અરજદારશ્રી CHIRAG AMBALIYAની અરજી આથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૭ હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.
- અરજદારને સદર ગુનાના કામે અલગ અલગ બેન્કો સીઝ કરવામાં આવેલ કુલ રોકડ રકમ રૂ. 338996.25/- પુરાની દોઢી રકમના જાત જમીન(બોન્ડ) તથા તેટલી જ રકમના સદ્ધર જમીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.
- વધુમાં હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જમીન તથા સદ્ધર જમીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ ફરીયાદી તથા જેમાં નાણાં સીઝ થયેલ છે તે બેન્કને કરવી અને જે બેન્કમાં નાણાં ફીઝ થયેલ છે તે બેન્ક સામાવાળાના બેંક **Axis Bank, State Bank of India, State Bank of India, Indian Bank (including Allahabad Bank), State Bank of India, State Bank of India, Bank of Baroda (Including Vijaya Bank and Dena Bank), Bank of Baroda (Including Vijaya Bank and Dena Bank), South**

**Indian Bank, bank of india, Axis bank, Andhra Pradesh Gramin Vikas Bank, Axis Bank, Federal Bank** ના અગુક્રમે ખાતા નંબર **920010054718171, 35446828450, 39760155701, 6634934200, 33528327025, 20178111120, 48080100004913, 40900100009749, 632053000003958, 875410110000796, 911010008014885, 73196723126, 0923020007567823, 17440200003449** માંથી અગુક્રમે રૂ. 76000/-અને 10943અને 20905/-અને 1002/- અને 50000/- 17000/-, 28584/-, 6712/-, 7000/-, 20000/- અને 100000/- 17000/- , અને 6208/-, 15000/- મળી કુલ રૂ .376354/- જમા છે તે રકમ અરજદાર ખાતુ ધરાવતી બેન્ક Axis Bank ના ખાતા નંબર 921010030193324 માં જમા કરાવી અત્રેની અદાલતને જાણ કરવી.

- સદર તકરારી નાણાં બાબતે શંકાસ્પદ ખાતાના ધારક કોઈ કાર્યવાહી કરે તો અરજદારે સદર રકમ પરત જમા કરાવવી.

સુરત.

તારીખ-:

૧જમાંએડી. સીની. સિવિલજજઅને  
એ.સી.જે.એમ.,સુરત.

Outward. No.: - /2024  
14<sup>th</sup> ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M. SURAT  
Date:

To,  
The Police Inspector,  
Jahangirpura Police Station,  
Surat City.

Subject: Application U/s. 457 of Cr.Pc. to return the Muddamal to the applicant Mr./Ms/Mrs.  
CHIRAG AMBALIYA in Criminal Inquiry no. CRMA/J/

In connection with the above subject matter, the applicant preferred said application before the Hon'ble court to get Muddamal money, which was freeze U/s. 102 of Cr.Pc. The court is ordered as under

Order

The application u/s. 457 of Criminal Procedure Code is hereby allowed. It is order to return the amount of Rs. 338996.25/- which was seized in connection with the above-mentioned offence, shall be returned to the present applicant as interim custody, on furnishing surety and personal bond of one and a half sum of seized amount in concerned police station, subject to the following conditions and till the final disposal of the case. It is further ordered that, as per the order of the court, on furnishing the surety and personal bail bond in the police station by the applicant, the police officer have to inform about the said process as well as informed regarding the order of the court to the concerned bank. It is also ordered to the bank that, after receiving the information from the police office about the order of the court as well as information regarding to comply process of surety and personal bond, the total amount of Rs. 376354/- which is deposited in the (1) 76000/- in the Account No: 920010054718171 of Axis Bank, (2) 10943 /- in the Account No. 35446828450 of State Bank of India (3) 20905 /- in the Account No: 39760155701 of State Bank of India (4) 1002/- in the Account No: 6634934200 of Indian Bank (including Allahabad Bank) (5) 50000 /- in the Account No: 33528327025 of State Bank of India (6) 17000 /- in the Account No: 20178111120 of State Bank of India (7) 28584 /- in the Account No: 48080100004913 of Bank of Baroda (Including Vijaya Bank and Dena Bank) (8) 6712 /- in the Account No: 40900100009749 of Bank of Baroda (Including Vijaya Bank and Dena Bank) (9) 7000 /- in the Account No: 632053000003958 of South Indian Bank (10) 20000 /- in the Account No: 875410110000796 of bank of india (11) 100000/- in the Account No: 911010008014885 of Axis Bank (12) 17000 /- in the Account No: 73196723126 of Andhra Pradesh Gramin Vikas Bank (13) 6208/- in the Account No: 923020007567823 of Axis Bank (14) 15000 /- in the Account No: 17440200003449 of Federal Bank has to be transferred and deposited to the applicant's A/c. No. 32453397388 (SBIN0011049) of State Bank of India . The bank is directed to inform about the comply of order to the Court and concerned police station within 10 days, after receiving the information of court order from the police station.

Terms: -

1. The applicant will have to produce the said amount before this Hon'ble when court ordered it.
2. If the above-mentioned account holder or any other person made claims about the said amount and proves his interest, in those circumstances, the applicant will have to return the said amount.
3. The said muddamal amount should not be used or allowed to be used for any criminal purpose.
4. In the event of breach of any of the condition, the interim order stands automatically cancelled and the muddamal amount shall be confiscated again and the surety and amount of bail bond shall be recovered.

This order is pronounced in special sitting today on Date \_\_\_\_\_ and duly read and signed.

Place: Surat

Date:

Sd/-

14<sup>th</sup> ADDL.SR. CIVIL JUDGE & A.C.J.M. SURAT

According to the above order, regarding to return the seized Muddamal amount to the applicant, and inform about order of the court to the concerned bank after obtain Surety and personal bail bond and executing the order and send the necessary bond to the court without fail. It is further directed to the police officer in charge that, at the time of giving above intimation to the concerned bank, the following information must be mentioned.

"The concern bank should confirm that the alleged amount is deposited in the account of the accused from the bank account of the applicant and the concern bank shall return. The amount in the same account from which it has been deposited in the account of the accused in their bank"

By Order,

SUPT, 14<sup>th</sup> ADDL.SR. CIVIL JUDGE &  
A.C.J.M. SURAT.